

## પાઠ 9 પાઠ

### અમારા પડોશી

- સેજલ:** આવી રૂપાબહેન, અમારા નવા ઘરમાં તમારું સ્વાગત છે.
- રૂપા:** આભાર. બહેન તમારું ઘર તો ખૂબ જ સુંદર છે.
- સેજલ:** અમને પણ નવું ઘર અને નવા પડોશીઓ સારા લાગ્યા.
- રૂપા:** તમારું ઘર તો સુંદર છે જ. પણ બધા પડોશીઓ વિશે તમે કેવી રીતે જાણો છો.
- સેજલ:** બધાંનો તો હજી પરિચય થયો નથી. પણ આપ ભલા તો જગ ભલા, ખરુંને. રૂપાબહેન તમારાં બાળકો અને પ્રશાંતભાઈ ક્યાં ગયા છે?
- રૂપા:** બાળકો રમવા ગયાં છે અને એ તો હજી ઓફિસથી પાછા આવ્યા નથી.
- સેજલ:** શું બાળકો આવે નિશાળ નથી ગયાં?
- રૂપા:** તે નિશાળથી આવી ગયાં છે અને તેમના મિત્રોની સાથે રમવા ગયાં છે.
- સેજલ:** બેસોને, તમારે શી ચિંતા છે? તમારાં સાસુ તો કામગરાં છે.
- રૂપા:** હા, મારે તો કોઈ જ ચિંતા નથી. અમારી કામ કરવાવાળી બાઈ પણ સારી છે.
- સેજલ:** તમે ખરેખર ભાગ્યશાળી છો. શું કામવાળી બાઈ રસોઈનું કામ પણ કરે છે?

### हमारे पड़ोसी

- સેજલ:** આરૂ રૂપા બહન। હમારે ને ઘર મેં આપકા સ્વાગત હૈ।
- રૂપા:** બહનજી આપકા ઘર બહુત હી સુંદર હૈ।
- સેજલ:** હમેં મી નયા ઘર ઓર ને પડોસી અચ્છે લગે।
- રૂપા:** આપકા ઘર તો સુંદર હૈ હી। લેકિન સબ પડોસીયોં કે બારે મેં આપ કૈસે જાનતી હૈં।
- સેજલ:** સબ કા તો અમી પરિચય નહીં હુઆ। લેકિન, હમ મલે તો જગ મલા। સચ હૈ ન! રૂપા બહન આપકે બચ્ચે ઓર પ્રશાંત માર્હ કહાં ગે હૈં ?
- રૂપા:** બચ્ચે ખેલને ગે હૈં ઓર વે તો આફિસ સે અમી લૌટે નહીં।
- સેજલ:** કયા બચ્ચે આજ સ્કૂલ નહીં ગે હૈં?
- રૂપા:** વે સ્કૂલ સે લૌટ આે હૈં ઓર અપને મિત્રોં કે સાથ ખેલને ગે હૈં।
- સેજલ:** બૈટિે ન, આપકો કયા ફિકર હૈ ? આપકી સાસ તો ઉદમી હૈં।
- રૂપા:** હાં। મુઝે તો કુછ મી ચિંતા નહીં હૈ। હમારી કામ વાલી બાર્હ મી અચ્છી હૈ।
- સેજલ:** આપ સચમુચ બહુત માગ્યશાલી હૈં। કયા કામવાલી બાર્હ રસોઈ કા કામ મી કરતી હૈ ?

**રૂપા:** ના, તે રસોઈનું કામ નથી કરતી. તે ઘરનાં બીજા બધાં કામ કરે છે.

**સેજલ:** તે સવારે કેટલા વાગે આવે છે?

**રૂપા:** તે સવારે નથી આવતી. ફક્ત સાંજે આવે છે. અત્યારે તો તેણે કચરો-પૂંજો કાઢી લીધો હશે. કપડાં પણ ધોઈ લીધાં હશે. અને પાણી પણ ભરી લીધું હશે.

**સેજલ:** શું કામવાળી બાઈ કામ પૂરું કરીને જતી રહી હશે?

**રૂપા:** ના, તે હજી નહીં ગઈ હોય. સારું હવે હું જાઉં? મારાં સાસુ મંદિરે જઈ પાછાં આવી ગયાં હશે.

**સેજલ:** જરા બેસોને, ભારતીબહેન અને રમાબહેન પણ આવવાનાં છે. સાથે નાસ્તો કર્યા પછી જ જાઓ. દીકરી કાજલ ચાલ તું પણ માસીની જોડે નાસ્તો કરી લે.

**કાજલ:** મમ્મી હમણાં મારે કશું જ ના જોઈએ મેં તો માસીના ઘરે જમી લીધું હતું.

**સેજલ:** કેમ?

**કાજલ:** મારે મોરારી બાપુની કથા સાંભળવા જવું હતું.

**સેજલ:** આટલી જલ્દી તું જઈને આવી ગઈ?

**કાજલ:** હા, પણ જ્યારે હું ગઈ ત્યારે તેમની કથા તો પુરી થઈ ગઈ હતી. એટલે હું જલ્દી પાછી આવી ગઈ.

**સેજલ:** દીકરી સમયસર કામ કરતાં શીખો.

**કાજલ:** હા મમ્મી.

**સેજલ:** રૂપાબહેન જુઓ ભારતીબહેન અને રમાબહેન આવી રહ્યાં છે. હવે આપણે બધાં એક સાથે નાસ્તો કરીશું. આવો બહેનો રૂપાબહેન તમારો જ રાહમાં છે.

**રૂપા:** નહીં વહ રસોઈ કા કામ નહીં કરતી હૈ। વહ ઘર કે દૂસરે સમી કામ કરતી હૈ।

**સેજલ:** વહ સવેરે કિતને બજે આતી હૈ ?

**રૂપા:** વહ સવેરે નહીં આતી હૈ। સિર્ફ શામ કો આતી હૈ। અબ તક તો ઉસને કૂઝા-કચરા નિકાલ દિયા હોગા। કપડે મી ધો લિય હોંગે ઓર પાની મી ભર લિયા હોગા।

**સેજલ:** કયા કામ વાલી બાઈ કામ પૂરાકરકે ચલી ગઈ હોગી ?

**રૂપા:** નહીં, વહ અમી નહીં ગઈ હોગી। અબ મેં જાઝું? મેરી સાસ મંદિર જા કર વાપસ આ ગઈ હોંગી।

**સેજલ:** જરા બૈઠિય ન। ભારતી બહન ઓર રમા બહન મી આનેવાલી હૈં। સાથ મેં નાશતા કરને કે બાદ હી જાઈય। બેટી, ચલ તુ મી મૌસી કે સાથ નાશતા કરલે।

**કાજલ:** મમ્મી અમી મુઝે કુછ નહીં ચાહિય। મેંને તો મૌસી કે ઘર મેં ખા લિયા થા।

**સેજલ:** કયો ?

**કાજલ:** મુઝે મુરારી બાપૂ કી કથા સુનને જાના થા।

**સેજલ:** ઇતની જલ્દી તૂ જા કર આ ગઈ ?

**કાજલ:** જી, લેકિન જબ મેં ગઈ તબ ઉનકી કથા તો પૂરી હો ચુકી થી। ઇસલિય મેં શીઘ્ર હી લૌટ આઈ।

**સેજલ:** બેટી સમય પર કામ કરના સીખો।

**કાજલ:** જી હાં મમ્મી।

**સેજલ:** રૂપા બહન દેખો યહ ભારતી બહન ઓર રમા બહન આ રહી હૈં। અબ હમ સબ ઇક સાથ નાશતા કરેંગે। આઈય બહનોં। રૂપા બહન આપહી કે ઇન્તજાર મેં હૈં।

**રૂપા:** સારું થયું તમે આવી ગયાં. હું તો જવાની હતી.

**ભારતી, રમા:** સારું થયું તમે ગયાં નહીં.

**કાજલ:** માસી, તમે બધાં આવો. મેં ટેબલ પર નાસ્તો તૈયાર કરીને મૂક્યો છે.

**સેજલ:** આવો, નાસ્તો કરીએ.

**રૂપા:** अच्छा हुआ आप आ गईं। मैं तो जाने वाली थी।

**भारती, रमा:** अच्छा हुआ आप नहीं गईं।

**काजल:** मौसीजी, आप सब आईए। मैं ने टेबल पर नाश्ता तैयार करके रखा है।

**सेजल:** आईए, नास्ता करें।

### शब्दार्थ

गुजराती शब्द	हिंदी अर्थ
સ્વાગત	स्वागत
નવું	नया
પડોશી	पड़ोसी
પરિચય	परिचय
સાસુ	सास
ભાગ્યશાળી	भाग्यशाली
માસી	मौसी
કામગરાં	उद्यमी
કામવાળી	घर का काम करने वाली नौकरानी
કચરો-પૂંજો	कूड़ा-कचरा
ઘોઈ લીધાં હશે	धो लिए होंगे
કપડાં	कपड़े
કથા	कथा, धार्मिक प्रवचन
આપ ભલા તો જગ ભલા	आप भला तो जग भला (कहावत)
ખરું ને	सच है न

### अभ्यास

- I नीचे दिए गए वाक्यों का अभ्यास कीजिए।
- 1) मैं आ पुस्तक वांची लीधुं છે.

- 2) અમારી દુકાન દૂર આવેલી છે.
- 3) તે સવારે સાત વાગ્યાથી દુકાને ગયા છે.
- 4) બાળકો તો રમવા ગયાં છે.
- 5) પ્રશાંત ઓફિસે ગયા છે.

2.

- 1) મેં તો જમી લીધું હતું.
- 2) હું કથામાં ગઈ હતી.
- 3) કથા પુરી થઈ ગઈ હતી.
- 4) સુરેશ આવી ગયો હતો.

3.

- 1) તેણે કચરો-પૂંજો કાઢી લીધો હશે.
- 2) તેણે કપડાં પણ ધોઈ લીધાં હશે.
- 3) તેણે પાણી પણ ભરી લીધું હશે.
- 4) મારાં સાસુ મંદિરેથી આવી ગયાં હશે?

## II ઉદાહરણ કે અનુસાર ક્રિયા રૂપ બદલકર દો-દો વાક્ય બનાવો ।

1.

ઉદાહરણ: મેં વાંચ્યું છે.

મેં વાંચ્યું હતું.

મેં વાંચ્યું હશે.

- 1) મેં લખ્યું છે.
- 2) મેં કહ્યું છે.
- 3) મેં આપ્યું છે.
- 4) મેં લીધું છે.
- 5) મેં કહ્યું છે.

2.

ઉદાહરણ: તેં વાંચ્યું છે.

તેં વાંચ્યું હતું.

તેં વાંચ્યું હશે.

- 1) તેં લખ્યું છે.
- 2) તેં કહ્યું છે.

- 3) તે આખું છે.
- 4) તે લીધું છે.
- 5) તે કહ્યું છે.

3. ઉદાહરણ: તેણે વાંચ્યું છે.  
તેણે વાંચ્યું હતું.  
તેણે વાંચ્યું હશે.

- 1) તેણે લખ્યું છે.
- 2) તેણે કહ્યું છે.
- 3) તેણે આખું છે.
- 4) તેણે લીધું છે.
- 5) તેણે કહ્યું છે.

III बायी ओर दिए गए वाक्यांशों को दाहिनी ओर दिए गए उपयुक्त वाक्यांशों से सही प्रकार मिलान कीजिए।

- |                         |               |
|-------------------------|---------------|
| 1) બાળકો તો રમવા        | - લીધો હશે.   |
| 2) મારે કથામાં          | - લીધું હતું. |
| 3) સુરેશ આવી            | - લીધું હશે.  |
| 4) તેણે પાણી પણ ભરી     | - ગયો હતો.    |
| 5) અમારી દુકાન દૂર      | - ગયાં છે.    |
| 6) મેં તો જમી           | - જવું હતું.  |
| 7) તેણે કચરો-પૂંજો કાઢી | - આવેલી છે.   |

IV कोष्ठक में दिए गए उपयुक्त सर्वनामों का प्रयोग कर वाक्य पूरे कीजिए।

(તેઓ, અમારી, મારાં, મારે, તેણે)

- 1) ..... દુકાન દૂર છે.
- 2) ..... સાસુ આવી ગયાં હશે.
- 3) ..... પાણી ભરી લીધું હશે.
- 4) ..... કથામાં જવાનું હતું.
- 5) ..... દુકાને ગયા છે.

**V ઉદાહરણ કે અનુસાર કોષ્ટક મેં દિલે ગલે સહી શબ્દ કા સહી સ્થાન પર પ્રયોગ કર વાક્યો કા વિસ્તાર કીજિલે ।**

ઉદાહરણ: તમે ભાગ્યશાળી છો. (ખરેખર)  
તમે ખરેખર ભાગ્યશાળી છો.

- 1) હું માંદો છું. (ખૂબ જ)
- 2) મને તાવ આવે છે. (બે દિવસથી)
- 3) તે માંદો હતો. (ખૂબ જ)
- 4) તે હોશિયાર છે. (સૌથી)
- 5) મારે કામ છે. (ખરેખર)

**VI ઉદાહરણ કે અનુસાર કોષ્ટક મેં દિલે ગલે પ્રત્યેક ક્રિયા કે નૌ-નૌ વાક્ય બનાઝલે ।**

(બોલું, રમું, લઉં, જઉં, કરું)

ઉદાહરણ:

- 1) હું આવું છું.
- 2) હું આવ્યો.
- 3) હું આવીશ.
- 4) હું આવી રહ્યો છું.
- 5) હું આવી રહ્યો હતો.
- 6) હું આવી રહ્યો હોઈશ.
- 7) હું આવ્યો છું.
- 8) હું આવ્યો હતો.
- 9) હું આવ્યો હોઈશ.

**VII કોષ્ટક મેં દિલે ગલે હિંદી શબ્દો કે સમાનાર્થક ગુજરાતી શબ્દ કા પ્રયોગ કર વાક્ય પૂરે કીજિલે ।**

- 1) બાળકો \_\_\_\_\_ ગયાં છે. (ખેલને)
- 2) આ પુસ્તક \_\_\_\_\_ લીધું છે. (પઢને)
- 3) પડોશીઓ પરિચય \_\_\_\_\_ ગયાં છે. (કરને)
- 4) રમાબહેન દુકાને સાડીઓ \_\_\_\_\_ જાય છે. (લેને)
- 5) કાજલ \_\_\_\_\_ બેસે છે. (ખાને)

- 6) તમારાં સાસુ \_\_\_\_\_ ગયાં છે. (ઘૂમને)  
7) તેઓ ફિલ્મ \_\_\_\_\_ ગયા છે. (દેખને)

### पढ़िए और समझिए

#### પહેલો સગો તે પડોશી

પ્રવીણભાઈની બદલી અમદાવાદથી મુંબઈ થઈ છે. તેમણે ઘાટકોપરમાં અમારી પડોશમાં જ મકાન લીધું છે. મુંબઈમાં તેમનાં ઘણાં સગાં રહે છે. તેમના ફોઈ મલાડમાં રહે છે. તેમના મામા-મામી પાલ્લીમાં રહે છે. અચાનક એક દિવસ સવારે પ્રવીણભાઈને હાર્ટએટેક આવ્યો હતો. ખબર સાંભળીને પા કલાકમાં બધાં જ પડોશીઓ ભેગાં થયાં હતાં. ડૉક્ટરને તરત જ બોલાવી લીધા હતા. ડૉક્ટરની સલાહ પ્રમાણે તેમને દવાખાને લઈ ગયાં. બે દિવસ પછી તેઓ ભાનમાં આવ્યા હતા. તરત જ તેમની પત્ની સુધાબહેનને તાર કર્યો હતો. તાર વાંચીને તેમને કેટલી ચિંતા થઈ હશે? તે તરત જ અમદાવાદ છોડીને મુંબઈ પહોંચી ગયા હતાં. સમાચાર સાંભળીને પ્રવીણભાઈનાં માતા-પિતાને ખૂબ જ દુઃખ થયું હશે. પ્રવીણભાઈનાં પડોશીઓ સારા હતા. તેમણે પ્રવીણભાઈ અને સુધાબહેનની ખૂબ જ મદદ કરી. તેથી જ આપણા વડીલોએ કહ્યું છે કે પહેલો સગો તે પડોશી છે.

#### शब्दार्थ

ગુજરાતી શબ્દ	हिंदी अर्थ
બદલી	तबादिला
પડોશી	पड़ोस
સગાં	रिश्तेदार
ફોઈ	फूफी, बुआ
મામા-મામી	मामा-मामी
ડૉક્ટર	डाक्टर
હાર્ટએટેક	हृदयाघात
પા	पाव (चौथाई भाग), पंद्रह मिनट
તાર	तार (पोस्ट ऑफिस)
ચિંતા	फिक्र
અચાનક	एकाएक
કહેવત/કહેવાય	कहावत है, कहा जाता है

કલાક ઘંટા  
પહેલો સગો તે પડોશી પહલા રિશ્તેદાર પડોસી (કહાવત)

### अभ्यास

#### I નીચે દિે ગણ પ્રશ્નોં કે ઉત્તર અનુચ્છેદ કે આધાર પર ઢીજિે ।

- 1) પ્રવીણભાઈ અમદાવાદથી મુંબઈ શા માટે આવ્યા?
- 2) અચાનક પ્રવીણભાઈને શું થયું?
- 3) ડૉક્ટરે શી સલાહ આપી?
- 4) સુધાબહેન કોનું નામ હતું?
- 5) આ ફકરામાં કઈ કહેવતનો ઉપયોગ કર્યો છે?

#### II નીચે દિે ગણ હિંદી શબ્દોં કે સમાનાર્થક ગુજરાતી શબ્દ ઢીજિે ।

फुफी, तबादला, रिश्तेदार, फिक्र, छोटा, एकाएक, खबर

#### III હિંદી મેં અનુવાદ કીજિે ।

ભારતના દરિયા કિનારે આવેલા સુનામી ગ્રસ્ત વિસ્તારની અમે મુલાકાત લીધી છે. આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. આ વિસ્તારના લોકોના ફરી વસવાટ માટે સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ ઘણું કામ કરી રહી છે. આ વિસ્તારનું કામ પૂર્ણ થવા આવ્યું છે. આમ પણ આ વિસ્તારનાં કામ સારી રીતે થાય તે માટે અમારી એક ટીમ બનાવી હતી. તે ટીમ દરિયાકાંઠાનાં સુનામી ગ્રસ્ત વિસ્તારમાં ગઈ હતી અને સુનામી ગ્રસ્ત લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. હવે તે લોકો ધીમે ધીમે પહેલાં જેવી જિંદગી જીવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

#### IV ગુજરાતી મેં અનુવાદ કીજિે ।

कृष्ण और सुदामा मित्र थे। दोनों मित्र अवंतिका में, सांदिपनी ऋषि के आश्रम में साथ-साथ पढ़े थे।

कृष्ण द्वारिका के राजा बन गए थे। सुदामा गरीब थे। वे अपने बाल मित्र कृष्ण से मिलने द्वारिका गए। द्वारिका में कृष्ण ने सुदामा का बहुत सत्कार किया। दोनों मित्र गले मिले। कृष्ण की रानियाँ, कृष्ण और सुदामा का मिलन देख रही थीं। रानियों ने दोनों मित्रों का स्नेह समझ लिया था। सुदामा के पास चावलों की एक पोटली थी। उन्होंने सुदामा से



चावलों की पोटली छीन ली। कृष्णने चावल बहुत प्यार से खाए। चावल खाकर कृष्ण ने कहा: सुदामा, हम दोनों वन में जलाऊ लकड़ियाँ लेने गए थे। तब तुमने मेरे हिस्से के चने खा लिए थे। मैंने तुम्हें देख लिया था। लेकिन तुम झूठ बोले थे। मैंने तुम्हारे चावल खा लिए हैं। अब तुम ऋण मुक्त हुए। सुदामा ने कृष्ण का आशय समझ लिया था। सुदामा कुछ नहीं बोले। उन्होंने कृष्ण की ओर देखा। वे केवल मुस्कराए कृष्ण। "मैंने तुम्हारे मन की बात जान ली है। तुम महान हो।" दोनों मित्र फिर गले मिले। कृष्ण ने सोचा, सुदामा ने उसका आशय समझ लिया होगा। सुदामा ने सचमुच कृष्ण के कहने का अर्थ समझ लिया था।

कृष्ण तथा उनकी रानियों ने सुदामा की खूब सेवा की। कुछ दिन द्वारिका में रुककर, सुदामा अपने घर लौट गए।

## V अपने प्रिय मित्र के बारे में एक छोटा सा अनुच्छेद लिखिए।

### टिप्पणियाँ

- I इस पाठ में निम्न प्रकार के वाक्यों का परिचय दिया गया है।
1. 
 

1) મેં આ પુસ્તક વાંચી લીધું છે.	मैंने यह पुस्तक पढ़ ली है।
2) અમારી દુકાન દૂર આવેલી છે.	हमारी दुकान दूर (आई) है (दूरी पर है)।
3) તે સવારે સાત વાગ્યાથી જ દુકાને ગયા છે.	वे/वह सुबह के सात बजे से ही दुकान पर गए हैं।
4) બાળકો તો રમવા ગયાં છે.	बच्चे तो खेलने गए हैं।
5) પ્રશાંત ઑફિસે ગયા છે.	प्रशांत ऑफिस गए हैं।
  2. 
 

1) મેં તો જમી લીધું હતું.	मैंने तो खा लिया था।
2) હું કથામાં ગઈ હતી.	मैं प्रवचन में गई थी।
3) કથા પુરી થઈ ગઈ હતી.	प्रवचन पूरा हो गया था।
4) સુરેશ આવી ગયો હતો.	सुरेश आ गया था।
  3. 
 

1) તેણે કચરો-પૂજો કાઢી લીધો હશે.	उसने कूड़ा-कचरा निकाल लिया होगा।
2) તેણે કપડાં પણ ધોઈ લીધાં હશે.	उसने कपड़े भी धो लिए होंगे।
3) તેણે પાણી પણ ભરી લીધું હશે.	उसने पानी भी भर लिया होगा।
4) મારાં સાસુ પાછાં આવી ગયાં હશે.	मेरी सास वापस आ गई होंगी।

पूर्ण वर्तमानकाल के क्रियारूप के उदाहरण (1.) के वाक्यों में दिए गए हैं। गुजराती में भूतकालिक कृदंतों के साथ योजक क्रिया 'छे' (छे), 'छो' (छो), 'छुं' (छुं), 'छीअे' (छीए) लगाने से पूर्ण वर्तमान कालिक क्रियाएँ बनती हैं।

उदाहरण (2.) में पूर्ण भूतकाल के वाक्य दिए गए हैं। भूतकालिक कृदंतों के साथ योजक के भूतकालिक रूप 'हत्तो' (हतो), 'हत्ती' (हती), 'हत्तुं' (हतुं), 'हत्त' (हता) लगाने से पूर्ण भूतकालिक क्रियाएँ बनती हैं।

उदाहरण (3.) में पूर्ण भविष्यतकाल के वाक्य दिए गए हैं। भूतकालिक कृदंतों के साथ योजक क्रिया के वर्तमानकालिक रूप लगाने से पूर्ण भविष्यतकाल की क्रियाएँ बनती हैं। योजक क्रिया के भविष्यतकालिक रूप 'हशो' (हशो), 'हशे' (हशे) हैं। ध्यान दीजिए की गुजराती में भी हिंदी की तरह तीनों पूर्ण कालों में योजक क्रियाओं के पूर्व, भूतकालिक कृदंतोंका प्रयोग होता है। ये कृदंत पुरुष, लिंग और वचन के अनुसार बदलते हैं।

II उदाहरणार्थ नीचे दिए गए वाक्य पढ़िए।

### पूर्ण वर्तमानकाल

	एकवचन	बहुवचन
उत्तम पुरुष	(हं)/मैं वांची लीधुं छे. (मैं) मैंने पढ़ लिया है।	(अमे) अमे वांची लीधुं छे. (हम) हमने पढ़ लिया है।
मध्यम पुरुष	(तुं) तैं वांची लीधुं छे. (तुं) तुने पढ़ लिया है।	(तमे) तमे वांची लीधुं छे. (आप) आपने पढ़ लिया है।
अन्य पुरुष	(ते) तेणे वांची लीधुं छे. (वह) उसने पढ़लिया है।	(तेओ) तेमणे वांची लीधुं छे. (वे) उन्होंने पढ़ लिया है।

### पूर्ण भूतकाल

	एकवचन	बहुवचन
उत्तम पुरुष	मैं वांची लीधुं हत्तुं. मैंने पढ़ लिया था।	अमे वांची लीधुं हत्तुं. हमने पढ़ लिया था।
मध्यम पुरुष	तैं वांची लीधुं हत्तुं. तुने पढ़ लिया था।	तमे वांची लीधुं हत्तुं. आपने पढ़ लिया था।

अन्य पुरुष	तेणे वांची लीधुं હતું. उસ ને પઢ લિયા થા।	તેમણે વાંચી લીધું હતું. ઉન્હોં ને પઢ લિયા થા।
------------	---	--

### पूर्ण भविष्यत्काल

	एकवचन	बहुवचन
उत्तम पुरुष	में वांची लीधुं હશે. મૈને પઢ લિયા હોગા।	अमे वांची लीधुं હશે. હમ ને પઢલિયા હોગા।
मध्यम पुरुष	तें वांची लीधुं હશે. તુને પઢ લિયા હોગા।	तमे वांची लीधुं હશે. આપને પઢલિયા હોગા।
अन्य पुरुष	तेणे वांची लीधुं હશે. उસ ને પઢ લિયા હોગા।	તેમણે વાંચી લીધું હશે. ઉન્હોંને પઢલિયા હોગા।